



# શિયાળ ઝટુના મુખ્ય પાકોના રોગો અને તેનું નિયંત્રણ

ડૉ. ડી. એસ. કેલૈયા, ડૉ. કે. કે. કષાજારીયા, ડૉ. જે. આર. તળાવીયા, ડૉ. સી. એમ. ભાલીયા અને  
ડૉ. એસ. વી. લાઠીયા

વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,  
જૂનાગઢ

# ઘઉ

પાનનો બદામી ગેરુ	એક બીજાથી અલગ છુટા છવાયા નારંગી રંગનાં ભૂખરા ઉપસેલા ટપકાં પાન તથા પર્ણ દંડ ઉપર જોવા મળે છે.	રોગ પ્રતિકારક જાતો જી ડબલ્યુ ૫૧૩, જી ડબલ્યુ ૪૮૮, જી ડબલ્યુ ૪૬૫, જી ડબલ્યુ ૪૬૩, જી ડબલ્યુ ૩૨૨ અને જી ડબલ્યુ ૩૬૬, જી ડબલ્યુ ૪૮૬ નો ઉપયોગ કરવો. સમયસરના વાવેતરમાં (૧૫ નવેમ્બર) દરેક પ્રકારના રોગ ઓછા આવે છે. રોગાં ખેતરમાં દેખાય કે તરતજ મેન્કોરેબ ૭૫% વે.પા. (૨૬ ગ્રામ/૧૦ લિટરપાણીમાં) અથવા પોપીકોનેઝોલ (૧૦ મીલી/૧૦ લિટર પાણીમાં) ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. જરૂર જણાય તો વધારાના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.
દાંડીનો ગેરુ	એક બીજાના સાથે ભણી લંબગોળાકાર ઉપસેલા કથ્થદ્ધ રંગનાં ટપકાં પાકની પાછલી અવસ્થામાં પાન, પ્રકાંડ તથા ઉબી ઉપર જોવા મળે છે.	



Prescott, J.M., P.A. Burnett, E.E. Saari et al. 1986  
Wheat Diseases and Pests: A Guide for Field  
Identification. CIMMYT, Mexico, D.F., Mexico

<p>કાળા ટપકાંનો રોગ</p>	<p>મોડુ વાવેતર (૧૫ નવેમ્બર પછી ) કરવામાં આવે તો રોગ આવવાની શક્યતા વધે છે. ઘઉને થેશર વડે કાઢ વામાં ન આવે ત્યાં સુધી રોગના ચિંહો દેખાતા નથી. ઘઉના દાણાના ભૂણનો ભાગ કાળો પડી દાણાની ચમક ઘટી જાય છે. બજારમાં કિંમત ઓછી આવે છે.</p>	<p>મોડુ વાવેતર ન કરવું. છેલ્લુ પિયત આપતી વખતે કયારામાં પાણી વધારે પડતું ભરાવા ન હેવું. રોગ નિયમિત આવતો હોય તો દાણા બેસવાના સમયે મેન્કોઝેબ ૭૫% વે.પા.(૨૬ ગ્રામ/૧૦ લિટર પાણી ) નો છંટકાવ કરવો</p>
---------------------------------	--	---



# જીરું

ચરમી	<p>રોગ પાકની ત૦ થી ત૫ દિવસની અવસ્થાએ દેખાય. શરૂઆતમાં પાન પર કથાઈ રંગના ટપકા પડે. ધીરે ધીરે ટપકાનું કદ વધતા આખા પાન કથાઈ રંગના બને. રોગની ઉગ્રતા વધતા ડાળી અને થડ પર બદામી થી કાળા રંગનાં ધાબા જોવા મળે. ધાબા પડે ત્યાંથી ડાળીઓ નમી પડે અને છેલ્લે આખો છોડ સેકાઈ જાય. ઝાકળ આવતા કુગના અસંખ્ય બીજાણુઓ બને. જે બીજા છોડમાં ચેપ લગાડે. નાના છોડમાં રોગ લાગે તો કુલ બેસતા નથી. કુલ અવસ્થાએ રોગ લાગે તો દાણા બેસતા નથી અને બેસે તો ચીમળાયેલા હલકા અને કાળા રંગના જોવા મળે. કમોસમી વરસાદમા આ રોગ ઝડપથી પ્રસરે.</p>	<p>બીજને થાયરમ દવાની માવજત એક કિલોગ્રામ બીજ દિઠ ઉ ગ્રામ પ્રમાણે આપવી. પાક ત૦ દિવસનો થાય ત્યારથી મેન્કોઝેબ દવાના ૦.૨% (૨૫ ગ્રામ/૧૦ લિટર) અથવા મેટીરામ ૫૫ પાયરાકલોસ્ટ્રોબીન પ ડબલ્યુ.જી. (૩૦ ગ્રામ/૧૦ લિટર) અથવા પાયરાકલોસ્ટ્રોબીન ૧૩.૩ ' ઈપોકઝીકોનાઝોલ પ એસ.ઈ. (૧૫ મીલી/૧૦ લિટર) વાળા દ્વારાણમાં ઉ થી ૪ છંટકાવ ૧૦-૧૨ દિવસનાં અંતરે વારાફરતી કરવા. જીરાનો પાક એક જગ્યાએ દર વર્ષે ન લેવો, વાવેતર નવેમ્બર માસમાં હંડી રૂતુમાં કરવું. કયારા નાના રાખવા, પિયત હલકું આપવું. પછાટે પાણી ન ભરાવા દેવું. નાઈટોજનયુક્ત ખાતરનો વધુ ઉપયોગ ન કરવો, રોગિષ્ટ છોડનો ઉપાડી નાશ કરવો અને જીરાનું ઘાટું વાવેતર ન કરવું.</p>
------	---	---



ભૂકી છારો	<p>આ રોગ પાકમાં ફુલ અવસ્થાએ જોવા મળે. શરૂઆતમાં છોડના નીચેના પાન અને થડ પર સફેદ ડાઘા પડે. સમય જતા કુગની વૃદ્ધિ છોડના જમીન ઉપરના બધા જ ભાગો પર જોવા મળે. પરિણામે છોડ પર સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય. પાછળથી રાખોડીયા રંગમાં ફેરવાય. રોગ લાગેલ છોડનો વિકાસ અટકે. દાણા બેસતા નથી. બેસે તો સફેદ રંગનાં અને અપુરતા વિકાસવાળા હોય. પરિણામે વજન અને ગુણવત્તા ઘટે.</p>	<p>સંરક્ષણાત્મક પગલા તરીકે પાક રૂપ દિવસનો થાય કે રોગની શરૂઆત થાય કે તુરત જ છાવ્ય ગંધક <math>0.2\%</math> (૩૦ ગ્રામ/૧૦લિટર) અથવા હેકઝાકોનેઝોલ <math>0.004\%</math> (૧૦ મિ.લી./૧૦ લિટર) અથવા મેટીરામ પપ પાયરાકલોસ્ટ્રોબીન પ ડબલ્યુ.જી. (૩૦ ગ્રામ/૧૦ લિટર) ના છાવણા ર થી ઉંટકાવ વારાફરતી કરવા.</p>
-----------	---	---



સુકારો

સામાન્ય રીતે ૨૫-૩૦ દિવસનો પાક થાય ત્યારે આ રોગ જોવા મળે. છોડના ફૂણા ડોકા અને ડાળીઓ અચાનક નમી પડે. ત્યારબાદ રોગિષ્ટ છોડ સુકાઈ જાય. ખેતરમાં રોગ લાગેલ છોડની કુંડીઓ જોવા મળે. જે વધારે વિસ્તારમાં પ્રસરે. દાણા બેસતા નથી. દાણા બેસેલ છોડમાં રોગ લાગે તો દાણાનો વિકાસ થતો નથી.

એકની એક જમીનમાં જીરાનો પાક ન લેવો. તંદુરસ્ત બિયારણ પસંદ કરવું. બીજને ચરમીના રોગ માટે જણાવેલ ફુગનાશક દવાની માવજત આપીને વાવવા. ૫૦૦ કિ.ગ્રા. ગળતિયું ખાતર/એરંડીના ખોળમાં ૫ કિ.ગ્રા. ટ્રાઈકોડર્મા હારજેનીયમ ફુગના બીજાણુંનું મિશ્રણ કરી વાવણી સમયે જમીનમાં ઉમેરવાથી રોગનું નિયંત્રણ થાય .



# ધાણા, અજમા, સુવા, મેથી અને વરીયાળી

ભૂકી છારો	<p>છોડના નીચેના પાન પર સફેદ છારી જોવા મળે. ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં થડ, ડાળી અને પાન પર સફેદ ફુગની વૃદ્ધિ જોવા મળે. પાક દૂરથી સામાન્ય લીલા રંગને બદલે રાખોડીયા રંગનાં જોવા મળે. ઘણી વખત દાણા પર પણ સફેદ છારી જોવા મળે.</p>	<p>સંરક્ષણાત્મક પગલા તરીકે પાક ૪૫ દિવસનો થાય કે રોગની શરૂઆત થાય કે તુરત જ છાવ્ય ગંધક ૦.૨% (૩૦ ગ્રામ/૧૦ લિટર) અથવા હેકઝાકોનેઝોલ ૫ ઈ.સી. ૦.૦૦૫% (૧૦ મિ.લી. /૧૦ લિટર ) ના છાવણા રથી તુ છંટકાવ કરવા.</p>
-----------	---	--



## ચણા

<b>વામન છોડ</b> <p>આ રોગ પાકની શરૂઆતની અવસ્થામાં આવી જાય તો છોડ કદમાં નાનો રહી જાય છે. બે ગાંઠ વચ્ચેનું અંતર ઘટી જાય છે. પાછલી અવસ્થામાં રોગ લાગે તો પાન પીળા અથવા ભૂખરા, તામ્ર રંગના થઈ જાય છે. પાન અને થડ બરડ અને જાડા થઈ જાય છે. મુળ કાળા થઈ જાય છે.</p>	<p>રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું. રોગિષ્ટ છોડ ખેતરમાં દેખાય કે તૂરતજ ઉપાડી નાશ કરવો. આ રોગો મોલોમશી જેવી રસ ચૂસતી જીવાતો મારફતે ફેલાતા હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા જરૂરત મુજબ છંટકાવ કરવો.</p>
---	--



# આંબો

ભૂકી  
છારો

મોરની દાંડી ઉપર સર્કેદ છારી જોવા મળે છે. જે પાછળથી બદામી રંગની થાય છે. આ રોગના આક્રમણથી ફલિનીકરણ થાય તે પહેલા અથવા ત્યાર પછી કૂમળો મોર ખરી જાય છે. રોગનું પ્રમાણ વધતાં નાના ફળ, કૂમળા પાન અને પણ્ણંડ પર છારી દેખાય છે. રોગગ્રસ્ત નાના ફળો કરમાઈ ખરી પડે છે.

આ રોગને સૂકું અને ઠંડુ વાતાવરણ વધુ માર્ફક આવે. આથી શિયાળામાં મોરની શરૂઆત થતાં જ આ રોગની અસર જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે મોર બેસવાની શરૂઆતમાં કાર્બેન્ડેજીમ ૫૦ વે. પા. (૦.૦૫ ટકા) અથવા હેકઝાકોનેઝોલ ૫ ઈ.સી. ૦.૦૦૫% નો છંટકાવ કરવો.



## વાનસ્પતિ ક વિકૃતિ

## ફૂલની વિકૃતિ

આંબાની ડાળીમાં ટોચના પાન શરૂઆતમાં જાડા, ટૂંકા, દળદાર બને છે અને તેની કુદરતી લાક્ષણિકતા ગુમાવે છે. નવો ફાલ આવતાં નાની ડાળીઓ ગુચ્છામાં ફૂટે છે. પાન પણ નાના અણીદાર એકત્રિત રીતે ગુચ્છામાં ગોઠવાયેલા હોય છે જે કાંઈક અંશે વિકૃત બની જાય છે. આ વિકૃતિ નાના છોડમાં (નર્સરી અવસ્થામાં) તેમજ નાની કલમોમાં (૪ થી ૮ વર્ષ) વધુ જોવા મળે છે.


રોગિષ્ટ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો. રોગિષ્ટ ભાગ પાછળનો ૧૫ સે.મી. જેટલો તંદુરસ્ત ભાગ પણ સાથે રાખી છટણી કરવી, તેમજ કાર્બોન્ડાઝીમ ૫૦% વે.પા. (૫ ગ્રામ /૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો. આ જ દવાનું (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ફૂલવણ બનાવી જાડની ઉમરને ધ્યાને લઈ ૧૦ થી ૧૫ લિટર પ્રમાણે થડની ફરતે જમીનમાં રેડવું. ફક્ત પ્રમાણિત, તંદુરસ્ત, રોગમુક્ત આંબાની કલમોનો નવા વાવેતર માટે ઉપયોગ કરવો. ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે બાહ્ય લક્ષણો પરથી વિકૃતિ ઓળખી તેના પુષ્પવિન્યાસનો નાશ કરવો. મૂલકાંડ માટે પણ જે જાડ આવી વિકૃતિથી મુક્ત હોય તેનાજ ગોટલા પસંદ કરવા. ઓક્ટોબર માસના પહેલા અઠવાડિયામાં નેથેલીન એસિટિક એસિડ (એન.એ.એ.) ૨ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં (૨૦૦ પીપીએમ) ઓગાળી છંટકાવ કરવો.



## કાલવ્રણ

પાન ઉપર ઘેરા બદામી રંગના ટપકાં પડે. પુષ્પગુચ્છ અને નાના ફળ પર સૂક્ષ્મ કાળા ટપકાં પડે છે જેથી કૂલો ખરી પડે છે. મોરની દાંડીની બદામી અને કાળાશ પડતા ધાબા પડે છે જેથી આખો મોર સુકાઈને ખરી પડે છે. કેરી ઉતારી લીધા બાદ તેના ડીચા મારફતે ફળોમાં રોગનો ચેપ દાખલ થાય છે. કેરી સડવા માંડે છે.

જાડ પરથી કેરી વેડી લીધા પછી સૂકાયેલી ડાળીઓની છાંટણી કરી જુખમવાળા ભાગ ઉપર બોડોપેસ્ટ (મોરથુથું ૧ કિ.ગ્રા. ' કળીચૂનો ૧ કિ.ગ્રા. ' ૧૦ લિટર પાણી ) લગાડવી અથવા બોડોમિશ્રણ ૦.૮% (મોરથુથું ૮૦ ગ્રામ ' કળી ચૂનો ૮૦ ગ્રામ ' ૧૦ લિટર પાણી ) તેમજ કાર્બોન્ડાઝીમ ૫૦% વે.પા. (૫ ગ્રામ/૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવાથી પણ આ રોગનું નિયંત્રણ થાય છે.



# શાકમાજીના પાકો

ઘરુમૃત્યુનો રોગ	<p>ઘરુવાડીયામાં જો ગીયોગીય ઘરુ ઉછેર કરવામાં આવે તો કુગથી થતો આ રોગ બે તબક્કે જોવા મળે.. જમીનમાં બીજનાં અંકુર ફુટતા પહેલા ઘરુનો સડો. જમીનમાંથી ઘરુ બહાર નીકળ્યા પછી ઘરુનો સડો. આ રોગને પરિણામે ઉગાવો ઓછો મળે છે. છોડની સંખ્યા, ઘરુની સંખ્યા ઓછી મળે છે. ખાલા વધુ પડે છે.</p>	<p>જમીન સારા નિતાર વાળી અને ઉચાણવાળી હોવી જોઈએ (ગાઢી ક્યારા બનાવવા). રોગીષ છોડ મુણ સાથે ઉપાડી બાળીને નાશ કરવો. બીજને થાયરમ દવાનો ઊ ગ્રામ પ્રતિ કિલો બીજ દિંદ પણ આપવો. ઉનાળામાં ૧૫ દિવસ સુધી ઘરુવાડીયાની જમીન ઉપર પ્લાસ્ટિક પાથરી જમીન તપાવવી.</p>
-----------------	---	---



# મરચી

જીવાણું થી થતો ટપકાનો રોગ	પાન ઉપર નાના પાણી પોચાં ટપકાં જોવા મળે છે. જે સમય જતાં કાળા પડે છે. પાન સુકાઈ ખરી પડે છે. ડાળીઓ તથા થડ ઉપર પણ આવા ટપકાં જોવા મળે છે.	બીયારણને વાવતા પહેલા થાયરમ દવા ૩.૦ ગ્રામ / કિલો બીજ દીઠ પટ્ટ આપીને વાવવુ. રોગની શરૂઆત જણાય કે તુરંત જ એક ગ્રામ સ્ટેપ્ટોસાઈકલીન ' ૩૦ ગ્રામ કોપર ઓક્સિકલોરાઇડ ૫૦ વે.પા. ૧૦ લી. પાણીમાં ઓગાળી ૨૦ થી ૨૫ દિવસનાં અંતરે ન્રણ છંટકાવ કરવા.
------------------------------------	---	--



# મરચી

## કાલવ્રણ

આ રોગને કારણે પાન પર અનિયમીત આકારનાં ટપકાં પડે છે. ડાળીઓ ઉપરથી કાળી પડી સુકાવા લાગે છે. મરચાં ઉપર કાળા કે રાખોડી રંગનાં ટપકાં પડે છે. બજાર કિંમત ઘટે છે. ગુણવત્તા પણ ઘટે.

બીજને વાવતા પહેલા પ્રતિ કિલો બીજ દીઠ ૨ થી ૩ ગ્રામ થાયરમનો પટ્ટ આપીને ઘરું ઉછેરવા. ફેરરોપણીના ૨ મહિના બાદ જાઈનેબ ૭૫ ડબલ્યુ. પી. ૦.૨ ટકાનું છાવણ ૧૫ દિવસનાં અંતરે ત્રણ વખત છાંટવું.



# રીંગણી

લઘુપણ  
નો રોગ

ચુસીયા પ્રકારની તડતડીયા જેવી જીવાતથી ફેલાતા અને શોષક પ્રકારની જંતુનાશક ફાયટોપ્લાઝમાંથી થતા આ રોગમાં પાન નાના રહે છે. દવાનો છંટકાવ કરવો. કુલ આવતા પહેલા જો રોગ લાગે તો તે પાન ગુચ્છ સ્વરૂપે રોગીષ છોડ ઉપાડીને નાશ દેખાય છે અને કુલ આવતા નથી. ફળ બેસતા નથી. કરવો. લાગેલ ફળ કઠણ રહે છે.

શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો. રોગીષ છોડ ઉપાડીને નાશ કરવો.



# કોબીવર્ગ

જીવાણું  
થી થતો  
કોહવારો

રોગ પાકની કિનારી ઉપર ટપકા રૂપે  
દેખાય છે. અને વી આકારમાં  
મુખ્ય નસ તરફ આગળ વધે છે. નસ  
કાળા રંગની બને છે. પણંડ અને  
થડની રસધાની પણ કાળી બને છે.

બિયારણને ૫૦ ડી. સે.ગ્રેડ તાપમાને ૩૦  
મીનીટ ગરમ પાણીમાં બોળી  
રાખવા. ઘરુવાડીયામાં ૧ ગ્રામ  
સ્ટેપ્ટોસાઈકલીન દવા ૧૦ લી.  
પાણીમાં ઓગાળીને છાંટવી.



# કੁੰਗણી

જાંબલી ધાખાનો રોગ	પાન ઉપર ક્રાક આકારનાં લાંબા રાખોડી રંગનાં મધ્યમ કથાઈ રંગના ડાઘ પડે છે. ડાઘની જગ્યાએથી પર્ણદંડ નમી પડે છે. પાન સુકાઈ જાય છે.	પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૭૫ વે. પા. ૨૫ ગ્રામ અથવા ઝાયરમ ૮૦ ડબલ્યુ. પી. ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમા ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૫ દિવસનાં અંતરે કરવા.
-------------------	---	---



કુંગળી નો પોચો સડો	<p>આ રોગ જીવાણુથી થાય છે. કુંગળીનો પોચો સડો ઉભા પાકમા તથા સંગ્રહ દરમ્યાન જોવા મળે છે. તેમજ શરૂઆતમા જો કુંગળીનુવાવેતરકંજ થી કરવામા આવે તો ખેતરમા ઉભા પાકમા રોગનું નુકશાન જોવા મળે છે. આ રોગની શરૂઆત પાક પાકતી વખતે કુંગળીના કંદાના ઉપલા ફોતરા પર થાય છે પરંતુ સડો સામાન્ય રીતે કંદા જમીનમાંથી ઉપાડી લીધા બાદ જોવા મળે છે. આવા રોગીષ્ટ કંદાઓને દબાવતા તેમાથી ચીકળું, ગંધાતી વાસવાળું પ્રવાહી નીકળે છે.</p>	<p>રોગીષ્ટ કંદા કુજીમાથી દૂર કરવા. કંદાની લળણી ગાંજો (થડ) સુકાયા બાદ જ કરવી. બીજ માટેના નાના કંદા (કંજી) અને કંદાના સંગ્રહ નીચા ઉષ્ણતામાને (૨૫ સે.ગ્રે.) અને હવાની અવરજવર સારી હોય તે જગ્યાએ કરવો.</p>
-----------------------------	--	--



# THANK YOU

